



# સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા)

ઈસરો સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ગુજરાત ૩૮૦ ૦૧૫

ફોન : (079) 2674 7612-36 ફેક્સ : (079) 2674 9048

www.spipa.gujarat.gov.in

## Frequently Asked Questions (FAQ)

**સ. સ્પીપા ની પ્રવેશ પરીક્ષા માટે વય મર્યાદા ક્યારે લેવાય છે? ફી કેટલી છે? પ્રવેશ પરીક્ષા માટે માટે ક્યાં પુસ્તકો વાંચવા જોઈએ? ક્વાસીસ ક્યાર થી ચાલુ થાય છે?**  
જ. ઓશર ના પાન ન. ૧ થી ૩ પુનઃ વાંચી લેવા વિનંતી.

**સ. શું હું આ વર્ષે (૨૦૧૬)માં યુપીએસસી ની પરીક્ષા આપી શકું?**

જ. યુપીએસસીની ઓનઅરજી કરવાની તારીખ 23rd April to 20th May 2016 છે. તે દરમિયાન <http://www.upsc.gov.in> પર જવું.

**સ. શું હું કોલેજના અંતિમવર્ષમાં યુપીએસસી પ્રવેશ પરીક્ષા આપી શકું?**

જ. યુપીએસસી પ્રિલીમ ઓગસ્ટમાં, એનું રીઝલ્ટ ઓક્ટોબરમાં અને મુખ્ય પરીક્ષા ડીસેમ્બર માં લોય. નિયમોનુસાર, ઉમેદવારે પ્રિલીમ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા માટે નવું ફોર્મ ભરવાનું હોય છે. એ સમયે ગ્રેજ્યુએશન માર્કશીટની નકલ આપવી પડે. બીજા શબ્દોમાં, આપેલ વર્ષના જો ઓક્ટોબર મધ્યભાગ સુધીમાં તમો ને ગ્રેજ્યુએશન ની માર્કશીટ મળી જવાની હોય તો પ્રિલીમ પરીક્ષા (ઓગસ્ટ) માં આપી શકાય.

**સ. શું હું સ્પીપામાં એડમીશન લીધા વગર, આપની લાઈબ્રેરી / રીડીંગ રૂમ ની સવલત લઈ શકું?**

જ. ના, તે શક્ય નથી.

**સ. શું હું કોલેજના અંતિમવર્ષમાં સ્પીપા પ્રવેશ પરીક્ષા આપી શકું?**

જ. વર્ષ ૨૦૧૬ની પ્રવેશ પ્રક્રિયા અને એડમીશન સમાપ્ત થઈ ગયેલ છે. પણ વર્ષ ૨૦૧૭ની બેચમાં પ્રવેશ લેવો હોય તો શરત છે કે જાન્યુઆરી ૨૦૧૭ પહેલા ગ્રેજ્યુએશન પૂરું કર્યાની માર્કશીટ/સર્ટીફિકેટ હાજર હોય.

**સ. સ્પીપાની પ્રવેશ પરીક્ષા ક્યારે યોજાશે?**

જ. વર્ષ ૨૦૧૬ની પ્રવેશ પ્રક્રિયા અને એડમીશન સમાપ્ત થઈ ગયેલ છે. આવતા વરસની પરીક્ષાની જાહેરાત ઓગસ્ટ માસમાં અખબારોમાં, સ્પીપાની ઓફીશીયલ વેબસાઈટ ([spipa.gujarat.gov.in](http://spipa.gujarat.gov.in)) અને ફેસબુક (<https://www.facebook.com/spipaofficial>) પર આવશે. તે મુજબ [ojas.nic.in](http://ojas.nic.in) પર જઈને ઓનલાઈન અરજી કરવી.

**સ. તમે સ્પીપાની પ્રવેશ પરીક્ષાની ક્યારે લેવાશે તેની એક સ્પષ્ટ તારીખ જાહેર કેમ નથી કરતા?**

પ્રવેશ પરીક્ષા યોજવા દર વરસે ૧૧,૦૦૦થી વધુ અરજી આવે છે. તે મુજબ અમારે અનેકવિધ સ્કુલ કોલેજોને પરીક્ષાકેન્દ્રો તરીકે ભાડે લેવા પડે. પરંતુ જો એને સમાંતર કોઈ અન્ય મોટી સરકારી પરીક્ષા કે મતદાન/મતગણતરી હેતુ એ કેન્દ્રો ભાડે લેવાઈ ગયેલા હોય તો એ મુજબ અમારે તારીખો એડજસ્ટ પણ કરવી પડે. એટલે હાલથી કોઈ એક સ્પષ્ટ તારીખ જાહેર ન કરી શકાય.

**સ. જો હું સ્પીપા પ્રવેશ પરીક્ષા ન આપુ પણ એ વરસની યુપીએસસી પ્રિલીમ પાસ કરી દઉં તો સ્પીપા માં પ્રવેશ મળે?**

જ. હા, સ્પીપાની આપેલ વર્ષની મુખ્ય પરીક્ષા બેચ માં પ્રવેશ મળી શકે.

સ. જો મેં અગાઉ ના વર્ષે યુપીએસસી ની પ્રિલીમ/મુખ્ય પરીક્ષા પાસ કરી હોય તો એના જોરે આ ફેરે ની સ્પીષા બેચમાં એડમીશન કે વાંચવા માટે કેવળ હોસ્ટલ લઈ શકું?

જ. નાં. આપેલ વર્ષ માં પ્રિલીમ પાસ કરી હોય તો સ્પીષાની આપેલ વર્ષની મેઈન્સ (મુખ્ય) પરીક્ષા બેચ માં પ્રવેશ મળે. જો આપેલ વર્ષ માં મુખ્ય પરીક્ષા પાસ કરી હોય તો સ્પીષાની આપેલ વર્ષ ની ઈન્ટરવ્યુ બેચમાં એડમીશન મળે.

સ. શું હું મુખ્ય પરીક્ષામાં નિબંધ નું પેપર ગુજરાતી માં અને ઓપ્શનલ (દાત. ઈજનેરી / મેડીકલ વગેરે) નું પેપર અંગ્રેજી માધ્યમ માં આપી શકું?

જ. ના, યુપીએસસી ના નિયમોનુસાર, તમોએ જનરલ સ્ટડીઝ અને નિબંધ નું પેપર જે માધ્યમમાં આપવાનું પસંદ કર્યું હોય, તે જ માધ્યમ માં ઓપ્શનલ નું પેપર આપવું પડે.

સ. જો હું મુખ્ય પરીક્ષામાં જનરલ સ્ટડીઝ અને નિબંધ માટે અંગ્રેજી માધ્યમ પસંદ કરું તો શું મારે ગુજરાતી લિટરેચર નું પેપર પણ અંગ્રેજી માં લખવું પડશે?

જ. ના, યુપીએસસી ના નિયમોનુસાર, સાહિત્ય (લીટરેચર) નું પેપર, જે તે ભાષાની લિપી માં જ લખવાના હોય છે. એટલે ભલે તમે અંગ્રેજી માં જનરલ સ્ટડીઝ / નિબંધ લખવાના હો, તોય ગુજરાતી લીટરેચર તો ગુજરાતી લીપીમાં જ લખવું પડે.

સ. શું હું યુપીએસસી ની મુખ્ય પરીક્ષા અંગ્રેજી માં અને ઈન્ટરવ્યુ ગુજરાતીમાં આપી શકું?

જ. હા, એવી પરિસ્થિતિ માં યુપીએસસી દ્વારા તમોને ઈન્ટરવ્યુ માટે દુભાષિયાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

સ. આપની સંસ્થામાં વ્યાખ્યાતાઓ ક્યાં માધ્યમમાં ભણાવે છે?

જ. જે તે વિષય ના ફેકલ્ટી પોતાની ઢબ મુજબ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં ભણાવતા હોય છે. સ્પીષામાં પ્રવેશ લેવા માંગતા ઉમેદવાર જોડે, આ ત્રણેય ભાષાઓ નું જ્ઞાન અપેક્ષિત છે.

સ. IPS અને અન્ય નોકરીઓ માટે ઉંચાઈ, છાતી, ચશમાંના નમ્બર વગેરેના ધારાધોરણો શું છે?

જ. કેન્દ્રસરકારના ઓફીશીયલ ગેઝેટમાં નિયમો આપેલા છે, જે નીચેની લિંક પર મળી જશે: <http://goo.gl/hHUKA9>

સ. હું બેંક, સ્ટાફ સિલેક્શન, ઈન્શ્યોરન્સ સેક્ટરની નોકરીઓ માટે પરીક્ષા આપવા માંગું છું તો શું ત્યાં સ્પીષા મને મદદ કરી શકે?

જ. સ્પીષાની ગ્રાઉન્ડ ફ્લોરની ઓફીસમાં CGRS વિભાગમાં માહિતી લેવી.

સ. જીપીએસસી, ગૌણ સેવા પસંદગી, PSI, DySO ઈત્યાદી માટે ક્યાં પુસ્તકો વાંચવા?

જ. ગુજરાત સરકારના નિયમોનુસાર અમો આ ક્લાસીસ, ગુજરાતના યુવાનો નું કેન્દ્ર સરકારની UPSC સિવિલ સેવા પરીક્ષામાં પ્રતિનિધિત્વ વધારવા હેતુ ચલાવીએ છીએ. અહિયાં કેવળ યુપીએસસીની માહિતી આપવામાં આવે છે.